



DZ-1901250101020300

Seat No. _____

B. A. (Sem. II) Examination

April - 2022

Economics : Paper - 3

(Principles of Economics-2)

(New Course) (Core)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) કોઈ પણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો.

- 1 સ્થિર અને અસ્થિર ખર્ચનો ખ્યાલ ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો. 14
- 2 સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતરસંબંધ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો. 14
- 3 પેઢીના કદ વિકાસના લાભાલાભની ચર્ચા કરો. 14
- 4 ઘટતા મળતરનો નિયમ આકૃતિની મદદથી સમજાવો. 14
- 5 વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. 14
- 6 ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. 14
- 7 શુષ્પિટરનો નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત સમજાવો. 14
- 8 નફાનો જોખમ અને અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો. 14
- 9 ટૂંકનોંધ લખો : 14
(1) વાસ્તવિક ખર્ચનો ખ્યાલ
(2) ઉદ્યોગ કદ વિકાસના લાભો
- 10 ટૂંકનોંધ લખો : 14
(1) આભાસી ભાડું
(2) કાચો નફો

ENGLISH VERSION

- Instructions :** (1) All questions have equal marks.
(2) Give the answers of any five questions.

- | | | |
|-----------|--|-----------|
| 1 | Explain the concept of fixed and variable cost with help of illustration and figure. | 14 |
| 2 | Clear the interrelationship between average cost and marginal cost with help of diagram. | 14 |
| 3 | Discuss the advantage and disadvantage of expansions size of firm. | 14 |
| 4 | Explain the law of diminishing returns with the help of diagram. | 14 |
| 5 | Explain the marginal productivity theory of distribution. | 14 |
| 6 | Explain the modern theory of rent. | 14 |
| 7 | Explain the innovation theory of profit by Schumpeter. | 14 |
| 8 | Examine the theory of profit in the context of risk and uncertainties. | 14 |
| 9 | Write short notes :
(1) The concept of real cost
(2) Advantage of expansion size of industry | 14 |
| 10 | Write short notes :
(1) Quasi rent
(2) Gross profit | 14 |